

# Visit of Foreign Minister of Spain to India

## સ્પેનનાં વિદેશ મંત્રીની ભારતની મુલાકાત

15 જૂન, 2022

સ્પેનનાં વિદેશી બાબતો, યુરોપિયન યુનિયન અને સહકારનાં મંત્રી મહામહિમ શ્રીમાન જોસે મેન્યુઅલ અલ્બારેસ દ્વારા 15 જૂન 2022 નાં રોજ તેઓની પ્રથમ ભારતની અધિકૃત મુલાકાત લેવામાં આવી હતી.

2. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે મુલાકાત લઈ રહેલ સ્પેનિશ વિદેશ મંત્રી સાથે દ્વિપક્ષીય વાર્તાઓ યોજી હતી જેમાં તેઓએ દ્વિપક્ષીય સંબંધોની સમગ્ર બાબતોની સમીક્ષા કરી હતી. બન્ને મંત્રી સંબંધોમાં નવી ગહનતા અને સતુષ્ટિ ઉમેરવા પ્રતિબદ્ધ થયા હતા. વ્યાપાર અને રોકાણો, પરસ્પર લોકો વચ્ચેનાં સંબંધો, આબોહવામાં સહકાર, ગ્રીન એનર્જી, વિજ્ઞાન અને ટેકનોલોજી, નવીનીકરણ અને સંરક્ષણ અને સલામતિનાં મહત્વનાં પ્રાથમિકતા ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરતી વિગતવાર ચર્ચાઓ કરી હતી. તેઓએ દ્વિપક્ષીય સંસ્થાનોની યંત્રણાઓની નિયમિત બેઠકો અને વિવિધ ક્ષેત્રોમાં વાટાઘાટો પર રહેલા એમઓયૂ/કરારોને વહેલાસર અંતિમ સ્વરૂપ આપવાની જરૂરીયાત પર ભાર મૂક્યો હતો. આ મીટિંગ દરમિયાન મંત્રીઓએ સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રોમાં સહકાર પર ઉદ્દેશની સંયુક્ત ઘોષણા પર હસ્તાક્ષર કર્યા હતા.

3. બન્ને નેતાઓએ સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કરવાની બાબતનું સ્વાગત કર્યું હતું જેનાં ભાગરૂપે એરબસ સ્પેન 56 C295 એરક્રાફ્ટ પૂરા પાડશે, જેમાંથી 40 વિમાનો ભારતમાં બનાવવામાં આવશે, અને સંરક્ષણ અને સુરક્ષા સહકાર વધારે ગહન બનાવવા સંમત થયા હતા મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત મારફત તેનાં રાષ્ટ્રિય સંરક્ષણ મેન્યુફેક્ચરિંગ પ્રોગ્રામમાં સહભાગી થવાનાં સ્પેનનાં રસ લેવાની બાબતને ભારત દ્વારા આવકારવામાં આવી હતી. તેઓએ આતંકવાદ, હિંસાકીય આત્યંતિકતા અને સાયબર ગુના સંબંધિત સામાન્ય પડકારોનો સામનો કરવામાં નિકટતાથી કામ કરવાની તેઓની પ્રતિબદ્ધતાનું પુનઃઉચ્ચારણ કર્યું હતું.

4. તેઓએ વધી રહેલા દ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણ જોડાણોનું સ્વાગત કર્યું હતું અને સામાન્ય હિતનાં નવા ક્ષેત્રોમાં તેઓનું વિસ્તરણ કરવા સંમત થયા હતા. તેઓએ સંતોષ સાથે નોંધ લીધી હતી કે દ્વિપક્ષીય વ્યાપાર કોવિડ-પૂર્વેનાં સ્તરથી પણ વધ્યો છે અને હજુ પણ વધારે વૃદ્ધિ થવાની નોંધપાત્ર સંભાવના રહેલી છે. તેઓ સંમત થયા હતા કે આઈટી, ફાર્મા અને રીન્યુએબલ જેવા ક્ષેત્રોમાં વધારે તકો રહેલી છે અને ગ્રીન હાઈડ્રોજન, ઈલેક્ટ્રિક મોબિલિટી, એડવાન્સ્ડ મટીરિયલ્સ, ઉંડા દરિયાની ખોજ જેવા ખોજ કર્યા વગરનાં ઉદ્ભવી રહેલા ક્ષેત્રો પણ છે જ્યાં બન્ને દેશો વધારે જોડાણ કરી શકે છે.

5. મંત્રીઓએ પારસ્પરિક હિતનાં સંખ્યાબદ્ધ પ્રાંતિય અને વૈશ્વિક મુદ્દાઓ પર ટ્રષ્ટિકોણોની આપ-લે કરી હતી અને આબોહવાનાં ફેરફાર, વૈશ્વિક આરોગ્ય, ટકાઉ વિકાસ અને આતંકવાદનો સામનો કવા જેવા સામાન્ય પડકારોને સંબોધવામાં પારસ્પરિક સમજણ અને સમર્થનની નોંધ લીધી હતી.

6. તેઓએ આ મહિનાનાં અંતમાં ભારત-યુરોપીયન યુનિયન એક્ટીએ વાટાઘાટો ફરીથી શરૂ કરવાની બાબતનું સ્વાગત કર્યું હતું. યુક્રેન પર, બન્ને મંત્રીઓએ પ્રવર્તમાન માનવીય સંકટ પર ચિંતા વ્યક્ત કરી હતી અને

તાન્કાલિત દુશ્મનાવટ સમાપ્ત કરવા માટે આલ્વાન કર્યું હતું. અફઘાનિસ્તાન પર, બન્ને પક્ષોએ અફઘાનિસ્તાનને અવરોધ વગર માનવિય સહાયતા સુલભ થાય તેની જરૂરીયાત પર અને પ્રાંતને અસ્થિર બનાવવા માટે આતંકવાદી સંગઠનો દ્વારા અફઘાનની ભૂમિનો ઉપયોગ ન કરવામાં આવે તેની જરૂરીયાત પર પ્રકાશ પાડ્યો હતો.

7. તેઓએ ઈન્ડો-પેસિફિક પ્રાંત પર વ્યૂહાત્મક રીતે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરીયાત પર અને સરખા વિચારો ધરાવતા રાષ્ટ્રો વચ્ચે જોડાણનાં પ્રયાસોનો પ્રચાર કરવાની બાબત પર ભાર મૂક્યો હતો. તેઓ એલએસી પ્રાંતમાં વિકાસ ભાગીદારી અને આર્થિક પ્રવૃત્તિઓમાં જોડાણની બાબતની ખોજ કરવા સંમત થયા હતા અને આ સંદર્ભમાં ઈબેરો-અમેરિકન કોન્ફરન્સની ચર્ચા કરી હતી. બન્ને મંત્રીઓએ સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય બહુપક્ષીય સંસ્થાઓમાં ભારત અને સ્પેન વચ્ચે સહકારની બાબતની પ્રશંસા કરી હતી.

નવી દિલ્હી

15 જૂન, 2022

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.